



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૦/૦૩/૨૦૧૯ બુધવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૫૦૭/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૯૭ કેસ કરી, ૯૦ વ્યક્તિઓને ઝડપી, ૭૭૭ લીટર દેશી દારૂ, ૫૧૩ બોટલ ઇંગ્લીશ દારૂ અને ૩૭૦ બિયર ટીન કબજે કર્યું હતું. તેમજ જુગારધારા હેઠળ ૦૧ કેસ કરી ૦૧ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૭,૩૬૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૫૦૮/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૨૨૪૯ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૮૦ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૫૦૯/૧૯

સોલા હાઇકોર્ટ: (૧) તુષારભાઈ પ્રવિણચંદ્ર અજમેરા (રહે.સુરસાગર ટાવર સાંઇબાબા મદિર પાસે સતાધાર બસ સ્ટોપ પાસે ઘાટલોડીયા) એ તા.૧૯/૩/૧૯ નારોજ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૧/૦૭/૨૦૧૨ બપોરના ૨/૦૦ વાગ્યાના સુમારે થલતેજ સુરધાર સર્કલ પાસે શ્રી રત્ન કોમ્પ્લેક્ષ “વેડીંગ સ્નેપર પ્રા.લી નામની કંપનીની ઓફિસ ખાતે આરોપી નવનીતભાઈ પુજારામ મોદી (રહે.ત્રિપદા બંગલા નં-૩૩ વેનેશીયાન વિલાસ મેપલ ગ્રીન રેસીડેન્સી સામે આનંદ નિકેતન સ્કુલ પાસે શીલજ ચોકડી) એ તુષારભાઈ પાસેથી લીધેલ રૂપિયા ૮૭,૪૭,૩૨૫/- પરત નહી ચૂકવી તુષારભાઈ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી બી.એમ.પરમાર ચલાવે છે.

સોલા હાઇકોર્ટ: (૨) ધવલભાઈ જીતેન્દ્રકુમાર રાવ (રહે.રત્નદીપ બંગ્લોઝ સુદર્શન ટાવર પાસે તપન સોસાયટી રોડ થલતેજ) એ તા.૧૯/૩/૧૯ નારોજ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે જુલાઇ/૨૦૧૭ થી આજદીન સુધીના સમયગાળા દરમ્યાન ધવલભાઈએ ઉદવાડા વલસાડ ખાતે મહાદેવ રેડી મેક્ષ નામનો રેતીના સ્ટોક યાર્ડમાં આરોપી અનીલ કમાભાઈ ચૌધરી(જેના સરનામાની ખબર નથી) સાથે ભાગીદારી કરી ધવલભાઈએ રૂપિયા ૧૦,૦૦,૦૦૦/- રોકાણ કર્યું હતું. ત્યાર બાદ આરોપી અનીલ ચૌધરી પાસેથી પૈસાની માંગણી કરતા નાણા નહી આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી બી.એમ.પરમાર ચલાવે છે.

સેટેલાઈટ: મનીષભાઈ રશીકલાલ સોની (ઉ.વ.૫૧)(રહે.કૈલાશ કોલોની આઇ.ઓ.સી.પેટ્રોલ પંપની સામે શીવરંજની રોડ સેટેલાઈટ) એ તા.૧૯/૩/૧૯ નારોજ સેટેલાઈટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૮/૦૯/૨૦૧૮ કલાક ૮/૩૦ થી ૯/૦૦ વાગ્યા દરમ્યાન સેટેલાઈટ શિવરંજની ચાર રસ્તા આઇ.ઓ.સી. પેટ્રોલપંપ સામે કૈલાશ કોલોની બંગ્લો નંબર-૧૬ માં આવેલ “એમ.આર.જવેલર્સ” ખાતે આરોપી શૈલેષભાઈ કાંતીલાલ મોદી (રહે.રિપલ એપાર્ટમેંટ જેઠાલાલ પાર્ક ની બાજુમાં નારાયણનગર રોડ પાલડી) એ મનીષભાઈ પાસેથી લીધેલ સોનાના દાગીના પૈકી લેવાના બાકી નિકળતા કુલ ૮૨૨ ગ્રામ સોનાના દાગીના કુલ કિંમત રૂપિયા ૨૫,૦૦,૦૦૦/- નહીં ચુકવી મનીષભાઈ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી કે.ડી.રવીયા ચલાવે છે.

ચોરી :-

સમાચાર યાદી નં.૫૧૦/૧૯

સેટેલાઈટ: લાલજીભાઈ ખોડાભાઈ ચુડાસમા (ઉ.વ.૩૩)(રહે.ઇડન ફ્લેટ ગોધરેજ ગાર્ડન સીટી જગતપુર ગામ ગોતા) એ તા.૧૯/૩/૧૯ નારોજ સેટેલાઈટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૮/૦૯/૨૦૧૮ કલાક ૮/૩૦ થી ૯/૦૦ વાગ્યા દરમ્યાન સેટેલાઈટ વિનશ ગ્રાઉન્ડમાં વિનશ સ્ટેટમ પ્રો.કસ્ટ્રક્શની સાઇડ પર માટી કામ કરતા ચામુંડા કાર્ટીઝ નામની કંપનીમાં આઇવા ડમ્ફર ટ્રકના ડ્રાઇવર પુખરાજભાઈ કસ્ટ્રક્શનને લગતી ચીજ વસ્તુઓ કુલ કિંમત રૂપિયા ૫,૦૦,૦૦૦/- ચોરી લઇ ગયો છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી એમ.બી.ઝાલા ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૫૧૧/૧૯

ગોમતીપુર: વલુબહેન ઉર્ફે બાલુબહેન અમરતભાઈ પટણી (ઉ.વ.૪૨) (રહે.ચુનીલાલ જેઠાલાલની ચાલી રાયપુર મીલ) એ અગમ્ય કારણસર તા.૧૮/૩/૧૯ સાજના ૭/૩૦ વાગ્યાના સુમારે રાયપુર ચાર રસ્તા ખાતે એસીડ પી લીધું હતું. સારવાર માટે તેમને સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે ગોમતીપુર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.એમ.ડામોર ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.